

MG-104

March-2022

B.Com., Sem.- I

SE-101(B) : Statistics – I

Time : 2 Hours]

[Max. Marks : 50]

- સૂચનાઓ :**
- (1) Section – I માં બધા પ્રશ્નોનો ગુણભાર સમાન છે.
 - (2) Section – I માંથી ગમે તે બે પ્રશ્નોના જવાબ આપો.
 - (3) Section – II માં પ્રશ્ન-5 ફરજિયાત છે.
 - (4) ગણન્યંત્રનો ઉપયોગ કરી શકાય.

SECTION – I

1. (A) નીચેની માહિતી પરથી સહસંબંધાંક શોધો : 10

| અક્ષસમાતની સંખ્યા | ડ્રાઇવરની ઉંમર | | |
|-------------------|----------------|---------|---------|
| | 25 – 35 | 35 – 45 | 45 – 55 |
| 0 | – | 13 | 27 |
| 1 | 24 | 9 | 13 |
| 2 | 10 | 5 | 5 |
| 3 | 6 | 3 | – |

- (B) ગુણાત્મક સંબંધ એટલે શું ? અને નીચેની માહિતી પરથી કમાંક સહસંબંધાંક શોધો : 10

| | | | | | | | | | | |
|---|----|----|----|----|----|----|----|----|----|----|
| x | 38 | 64 | 61 | 89 | 82 | 74 | 26 | 97 | 38 | 77 |
| y | 46 | 53 | 57 | 86 | 62 | 67 | 61 | 90 | 53 | 83 |

2. (A) નિયત સંબંધાંકોની વ્યાપ્તા આપો અને તેમના ગુણધર્મો સમજાવો. 10

- (B) નીચેની માહિતી પરથી બે નિયત સંબંધ રેખાઓનાં સમીક્ષા મેળવો : 10

| વિગત | ચલ x | ચલ y |
|----------------|------|------|
| મધ્યક | 34.5 | 41.5 |
| પ્ર.વિ. | 4 | 5 |
| સહસંબંધાંક (r) | 0.64 | |

$$Y = 25 \text{ માટે } X = 40 \text{ માટે } Y \text{ નું અનુમાન પણ મેળવો.}$$

3. (A) શરૂઆતનું પૂર્વનુમાન 80 અને $\alpha = 0.4$ લઈ ઘાતાંકીય સરળીકરણની રીતે નીચેની માહિતી પરથી પૂર્વનુમાન મેળવો : 10

| | | | | | |
|---------|------|------|------|------|------|
| વર્ષ | 2011 | 2012 | 2013 | 2014 | 2015 |
| ઉત્પાદન | 95 | 118 | 137 | 161 | 187 |

- (B) ધ્યાંકીય પૂર્વનુમાન એટલે શું ? અને નીચેની માહિતી પરથી દ્વિધાત્તી પરવલય વલણ મેળવો, તેમજ વર્ષ 2021નું પૂર્વનુમાન મેળવો : 10

| | | | | | |
|--------------------|------|------|------|------|------|
| વર્ષ | 2016 | 2017 | 2018 | 2019 | 2020 |
| વેચાણ (લાખ રૂ માં) | 3 | 7 | 13 | 21 | 31 |

4. (A) બાળમૃત્યુદરનું સૂત્ર જાગ્રાવો. નીચે આપેલી માહિતી પરથી બંને શહેરોના CDR અને SDR શોધો
તેમજ બે શહેરોના આરોગ્યની સરખામણી કરો : 10

| ઉંમર (વર્ષમાં) | શહેર A | | શહેર B | | પ્રમાણિત વસ્તી (હજારમાં) |
|-------------------|--------------------|------------------|--------------------|------------------|-----------------------------|
| | વસ્તી (હજારમાં) | મૃત્યુ સંખ્યા | વસ્તી (હજારમાં) | મૃત્યુ સંખ્યા | |
| 5 થી ઓછી | 17 | 1054 | 19 | 1235 | 18 |
| 5 – 20 | 23 | 1104 | 24 | 1128 | 25 |
| 20 – 45 | 35 | 1155 | 34 | 1190 | 33 |
| 45 – 60 | 12 | 1020 | 14 | 1176 | 11 |
| 60 થી વધુ | 7 | 658 | 8 | 736 | 8 |

- (B) શહેરની નીચે આપેલી માહિતી પરથી સાદો પ્રજનન દર (GFR), કુલ પ્રજનન દર (TFR) અને સાદો
જન્મ દર (CBR) શોધો. [શહેરની કુલ વસ્તી 4,40,000 છે.] : 10

| ઉંમર (વર્ષમાં) | સ્ત્રીઓની સંખ્યા (હજારમાં) | જીવિત જન્મેલાં બાળકોની સંખ્યા |
|----------------|----------------------------|-------------------------------|
| 18 – 22 | 19 | 1273 |
| 23 – 27 | 23 | 3105 |
| 28 – 32 | 27 | 4536 |
| 33 – 37 | 24 | 2856 |
| 38 – 42 | 21 | 1785 |
| 43 – 47 | 26 | 936 |
| 48 – 52 | 10 | 100 |

SECTION – II

5. નીચેના પ્રશ્નોના ટૂકડમાં જવાબ આપો (કોઈપણ પાંચ) : 10
- (1) જો 8 જોડકાં માટે સહવિચયરણની કિંમત 15 અને ચલ x અને y નું વિચયરણ અનુકૂળે 25 અને 16 હોય તો સહસંબંધાંક શોધો.
 - (2) જો A અને B સ્વતંત્ર ગુણધર્મો હોય અને $(AB) = 95$, $(\beta) = 130$ અને $(B) = 190$ હોય તો $(A\beta)$ શોધો.
 - (3) જો $b_{yx} = 0.75$ અને $b_{xy} = 0.60$ હોય તો r શોધો.
 - (4) જો x ની y પરની રેખાનું સમીકરણ $4x - 7y - 53 = 0$ હોય તો b_{xy} શોધો.
 - (5) સુરેખાના અન્વાયોજન કરવા માટે જરૂરી પ્રમાણ્ય સમીકરણો લખો.
 - (6) ઘાતાંકીય સરળીકરણની રીતમાં જો $X_3 = 178.88$, $S_3 = 159.32$ અને $T_3 = 13.04$ હોય તો ઘાતાંકીય સરળીકરણનો અચળાંક મેળવો.
 - (7) જો $\alpha = 0.3$, $S_1 = 147.4$, $T_1 = 0.72$ હોય તો શરૂઆતનું અનુમાન મેળવો.
 - (8) એક ગામમાં વર્ષ 2019 માં 450 બાળકોનો જન્મ થયો જે પૈકી 27 બાળકો એક વર્ષ દરમિયાન મૃત્યુ પામ્યાં. આ ગામનો બાળમૃત્યુ દર મેળવો.
 - (9) કોઈ એક શહેર માટે સાદો જન્મ દર = 77.4 અને કુલ વસ્તી 1,80,000 હોય તો જીવિત જન્મોની સંખ્યા મેળવો.
 - (10) વસ્તી વિષયક અંકડા એકદા કરવાની રીતોના નામ લખો.

MG-104

March-2022

B.Com., Sem.- I**SE-101 (B) : Statistics – I****Time : 2 Hours]****[Max. Marks : 50**

- Instructions :**
- (1) All questions in Section – I carry **equal** marks.
 - (2) Attempt any **two** questions in Section – I.
 - (3) Question No. 5 in Section – II is compulsory.
 - (4) Use of calculator is permitted.

SECTION – I

1. (A) Find the correlation coefficient from the following data : 10

| No. of accidents | Age of drivers | | |
|------------------|----------------|---------|---------|
| | 25 – 35 | 35 – 45 | 45 – 55 |
| 0 | – | 13 | 27 |
| 1 | 24 | 9 | 13 |
| 2 | 10 | 5 | 5 |
| 3 | 6 | 3 | – |

- (B) What is meant by association of attributes ? And find rank correlation coefficient from the following data : 10

| | | | | | | | | | | |
|---|----|----|----|----|----|----|----|----|----|----|
| x | 38 | 64 | 61 | 89 | 82 | 74 | 26 | 97 | 38 | 77 |
| y | 46 | 53 | 57 | 86 | 62 | 67 | 61 | 90 | 53 | 83 |

2. (A) Define regression coefficients and explain their properties. 10

- (B) Obtain the equations of two regression lines for the following data : 10

| Details | Variable x | Variable y |
|-----------------------------|------------|------------|
| Mean | 34.5 | 41.5 |
| S.D. | 4 | 5 |
| Correlation Coefficient (r) | 0.64 | |

Also, Estimate X for Y = 25 and Estimate Y for X = 40.

3. (A) Taking initial forecast 80 and $\alpha = 0.4$, obtain the forecast for the following data using exponential smoothing method : 10

| | | | | | |
|------------|------|------|------|------|------|
| Year | 2011 | 2012 | 2013 | 2014 | 2015 |
| Production | 95 | 118 | 137 | 161 | 187 |

- (B) What is meant by Business Forecasting ? And obtain second degree parabolic trend from the following data, also forecast for the year 2021 : 10

| Year | 2016 | 2017 | 2018 | 2019 | 2020 |
|-------------------|------|------|------|------|------|
| Sales (in lakh ₹) | 3 | 7 | 13 | 21 | 31 |

4. (A) State the formula of IMR. Find CDR and SDR of two cities from the following data and also compare health of two cities. 10

| Age (in years) | City A | | City B | | Standard Population (in '000) |
|-------------------|-------------------------|------------------|-------------------------|------------------|-------------------------------------|
| | Population (in '000) | No. of Deaths | Population (in '000) | No. of Deaths | |
| Less than 5 | 17 | 1054 | 19 | 1235 | 18 |
| 5 – 20 | 23 | 1104 | 24 | 1128 | 25 |
| 20 – 45 | 35 | 1155 | 34 | 1190 | 33 |
| 45 – 60 | 12 | 1020 | 14 | 1176 | 11 |
| Above 60 | 7 | 658 | 8 | 736 | 8 |

- (B) From the following information of a city, calculate GFR, TFR and CBR [Total Population of the city is 4,40,000] : 10

| Age (in years) | No. of Females (in '000) | No. of Live Births |
|-------------------|-----------------------------|-----------------------|
| 18 – 22 | 19 | 1273 |
| 23 – 27 | 23 | 3105 |
| 28 – 32 | 27 | 4536 |
| 33 – 37 | 24 | 2856 |
| 38 – 42 | 21 | 1785 |
| 43 – 47 | 26 | 936 |
| 48 – 52 | 10 | 100 |

SECTION – II

5. Answer the following questions (any five) : 10
- (1) For 8 pairs of observations, covariance is 15 and variance of x and y are 25 and 16 respectively. Find correlation coefficient.
 - (2) A and B are independent attributes. Find $(A\beta)$ if $(AB) = 95$, $(\beta) = 130$ and $(B) = 190$.
 - (3) If $b_{yx} = 0.75$ and $b_{xy} = 0.60$ then find r .
 - (4) If the equation of line of x , on y is $4x - 7y - 53 = 0$, then find b_{xy} .
 - (5) For a straight line, write normal equations required to fit the equation.
 - (6) In exponential smoothing method, if $X_3 = 178.88$, $S_3 = 159.32$ and $T_3 = 13.04$, then find exponential smoothing constant.
 - (7) If $\alpha = 0.3$, $S_1 = 147.4$, $T_1 = 0.72$, then find initial forecast value.
 - (8) In the year 2019, 450 births had observed in a village of which 27 children died before attaining their age of one year. Find the infant mortality rate of this village.
 - (9) For a city, crude birth rate = 77.4 and total population is 1,80,000. Find total number of live births.
 - (10) Write the name of methods used for collecting demographic statistics.